

63  
ETC

SARDAR PATEL UNIVERSITY  
S.Y.B.Sc. Third Semester(CBSC)] Examination 2022

16/06/2022, Thursday [ NC]

Session: [ Moon ] Time: 12 : 00 pm to 02 : 00 pm

Subject Code: US03CPHY02

Subject Title: Basic Solid State Electronics

N.B: (1) All the symbols have their usual meanings.

(2) Figures at the right side of questions indicate full marks

**Total Marks: 70**

**Write correct answer for each of the following MCQs.**

**Q: 1**

**[10]**

- 1 The transistor parameters are \_\_\_\_\_ dependent.
  - a) temperature
  - b) clipping
  - c) resistance
  - d) pressure
- 2 Transistors are used in \_\_\_\_\_ circuit.
  - a) rectifier
  - b) Amplifier
  - c) Zener diode
  - d) None of these
- 3 Which of the following h-parameter gives input impedance of C-E transistor?
  - a)  $h_{rf}$
  - b)  $h_{ie}$
  - c)  $h_{oe}$
  - d)  $h_{fe}$
- 4 A good biasing circuit establishes the operating point on a DC load line \_\_\_\_\_.
  - a) Near saturation region
  - b) Outside active region
  - c) At a middle of the active region
  - d) Near cut off region
- 5 With negative feedback the out impedance of the amplifier is \_\_\_\_\_.
  - a) increased
  - b) becomes infinite
  - c) decreased
  - d) remains constant
- 6 In negative feedback amplifier, the feedback voltage and input voltage are \_\_\_\_\_.
  - a) In same phase
  - b) In opposition phase
  - c) Both (a) & (b)
  - d) None of these
- 7 The voltage gain of emitter follower is always \_\_\_\_\_.
  - a) Less than unity
  - b) Greater than unity
  - c) infinite
  - d) less than 10
- 8 Write a full form of RFC is \_\_\_\_\_.
  - a) Radio frequency chock
  - b) Resistor frequency circuit
  - c) Radio frequency circuit
  - d) Resistor feedback circuit
- 9 The Wein bridge oscillator is used for generating \_\_\_\_\_ range of frequencies .
  - a) 10Hz to about 1M Hz
  - b) 1Hz to 1 M Hz
  - c) More than 1M Hz
  - d) Less than 10 H z
- 10 \_\_\_\_\_ circuit that generates an alternating voltage.
  - a) Diode
  - b) Amplifier
  - c) Oscillator
  - d) Rectifier

(P.T.O.)

(1)

**Q-2 Do as Directed (fill in the blanks and True or False) (08)**

- 1 Another name of the collector to base bias circuit is voltage feedback bias circuit. (True/ False)
- 2 Emitter bias circuit is used for impedance matching [buffering]. (True/ False)
- 3 In single stage transistor amplifier circuit \_\_\_\_\_ transistor is used.
- 4 The unit of out admittance ( $h_{o_e}$ ) is \_\_\_\_\_.
- 5 The demerit of negative feedback is reduction in gain. (True/ False)
- 6 Another name of the feedback network is \_\_\_\_\_.
  
- 7 The condition  $A\beta = 1$  is known as Barkhausen criterion of oscillation. (True/ False)
- 8 A quartz crystal exhibits a very important property known as \_\_\_\_\_ effect.

**Q-3 Write answers of any ten questions in brief (20)**

- 1 Write a need for bias stabilization.
- 2 Discuss limitations of fixed bias circuit.
- 3 Draw the circuit symbol for NPN and PNP transistor.
- 4 Write need of multistage amplifier.
- 5 Why dB is used?
- 6 Write applications of single stage amplifier.
- 7 Write the equation for input and output impedance of negative feedback amplifier.
- 8 Define: (1) current gain (2) voltage gain.
- 9 Write basic requirements of an oscillator circuit.
- 10 Draw the block diagram for series current and shunt voltage feedback network.
- 11 Explain the principle of working of the Wein bridge oscillator circuit.
- 12 Differentiate between sinusoidal and non sinusoidal oscillators.

**Q-4 Answer the following questions (Attempt any 4 out of 8) (32)**

- 1 What is voltage divider biasing circuit? Using approximate analysis, explain how to determine operating point of such circuit.
- 2 What is Q-point? Explain selection of proper operating point.
- 3 Discuss and derive 'h' parameters and its equivalent circuit with necessary circuit diagrams.
- 4 What are small signal amplifiers? Draw the circuit of such amplifier and discuss function of each component.
- 5 Explain voltage gain of feed-back amplifier using proper circuit diagram.
- 6 Discuss RC coupled amplifier without bypass capacitor using NPN transistor.
- 7 Write notes on "Hartley Oscillator" and Colpitt's Oscillator.
- 8 Write basic principles of RC oscillators. Discuss Phase-Shift Oscillator.

(2)

63  
ટીમ

SARDAR PATEL UNIVERSITY

સરદારપટેલ યુનિવેર્સિટી

S.Y.B.Sc. Third Semester(CBSC)] Examination 2022

B.Sc., 3<sup>rd</sup> semester [બેચ.સી ત્રિજી સત્ર]

Date (તારીખ) .16/06/2022 Day (દિવાં) : Thursday (શશીવાર)

Session: Nov/Time (સમય) : 12:00 pm to 02:00 pm

વિષય ક્રમાંક : (ભૌતિકશાસ્ક) US03 CPHY02

માળખું : Basic Solid State Electronics

N.B: (1) All the symbols have their usual meanings.

(2) Figure at the right side of questions indicate full marks  
Total Marks: 70

Write correct answer for each of the following MCQs.

Q: 1

નીચેના વૈકલ્પીક પ્રક્રિયાના સાચા જવાબ લખો.

[10]

- 1 ટ્રાન્ઝિસ્ટર ના પેરામીટરો \_\_\_\_\_ પર આધારીત છે.
  - a) તાપમાન
  - b) કલેપિગા
  - c) અવરોધ
  - d) દબાણ
- 2 ટ્રાન્ઝિસ્ટર નો ઉપયોગ \_\_\_\_\_ પરિપથ માં થાય છે.
  - a) રેફ્ટીફાયર
  - b) એમ્પલીફાયર
  - c) ડીનર ડાયોડ
  - d) એક પણ નહીં
- 3 નીચેના માંથી કોણા C-E ટ્રાન્ઝિસ્ટર ના h (hybrid)-પેરામીટરનો આંતરીક અવરોધ છે.
  - a)  $h_{rf}$
  - b)  $h_{ie}$
  - c)  $h_{oe}$
  - d)  $h_{fe}$
- 4 સારો બાયસ પરિપથ કિયાશીલ બિંદુનું ડિસી લોડ રેખાપર \_\_\_\_\_ એ વિસ્થાપન થાય છે.
  - a) સેચ્યુરેશન વિસ્તાર નજીક
  - b) કિયાશીલ વિસ્તાર ની બહાર
  - c) કિયાશીલ વિસ્તાર ની વરચે
  - d) કટ ઓફ વિસ્તાર નજીક
- 5 એમ્પલીફાયર નો ઝણા ફીડબેક સાથે નો બાબુ અવરોધ \_\_\_\_\_ હોય છે.
  - a) વધે
  - b) અનંત
  - c) ઘટે
  - d) અચળ
- 6 ઝણા ફીડબેકના આંતરીક વોલ્ટેજ અને ફીડબેક વોલ્ટેજ \_\_\_\_\_ હોય છે.
  - a) સરખી કળા માં
  - b) વીરુધ્ય કળા માં
  - c) અ અને બ બજે
  - d) એક પણ નહીં

③

(P.T.O.)

7 મીટર ફોલોઅર ની વોલ્ટેજ લબ્ધિ હંમેશા --- હોય છે.

a) 1 કરતા ઓછી

b) 1 કરતા વધુ

c) અનંત

d) 10 કરતા ઓછી

8 RFC નું પૂરું નામ --- છે.

a) રેડિયો આવૃત્તિ ચોક

b) અવરોધ આવૃત્તિ પરિપથ

c) રેડિયો આવૃત્તિ પરિપથ

d) અવરોધ ફીડબેક પરિપથ

9 . વેઇન બિજુ ઓસીલેટરની આવૃત્તિ ઉત્પન્ન કરવાનો વીસ્તાર \_\_\_\_\_ છે

a) 10Hz થી 1MHz

b) 1Hz થી 1MHz

c) 1MHz થી વધુ

d) 10Hz થી ઓછી

10 \_\_\_\_\_ પરિપથ ઉલ્ટસુલટ વોલ્ટેજ ઉત્પન્નકરે છે.

a) ડાયોડ

b) એમ્પલીફાયર

c) ઓસીલેટર

d) રેકટીફાયર

Do as Directed (fill in the blanks and True or False)

Q-2

માર્ગયા મુજબ કરો. (ખાલી જગ્યા ભરો અને સાચું અથવા ખોટું જણાવો)

(08)

1 કલેક્ટર બેઝ બાયસ પરિપથનું બિજુ નામ વોલ્ટેજ ફીડબેક બાયસ પરિપથ છે.  
(સાચું / ખોટું)

2 એમીટર બાયસ પરિપથનો ઉપયોગ અવરોધ મેચિગ માટે થાય છે. (સાચું / ખોટું)

3 એક સ્તરીય એમ્પલીફાયરના પરિપથમાં \_\_\_\_\_ ટ્રાન્ઝિસ્ટર નો ઉપયોગ થાય છે.

4 બાબ્ય એડમીટન્સ ( $h_{o_e}$ ) નો એકમ \_\_\_\_\_ છે.

5 લબ્ધીનો ઘટાડો એ ઝણ ફીડબેકનો ગેરલાભ છે. (સાચું / ખોટું)

6 ફીડબેક નેટવર્ક નું બીજુ નામ --- - છે.

7  $A\beta = 1$  ને ઓસીલેટરની બાર્કહુ સેન માપદંડ શરત કહેવાય છે. (સાચું / ખોટું)

8 ક્વાર્ટર્ઝ સ્ફટીક ખુબ અગત્યની લાક્ષણીકતા પ્રદશીત કરે તેને ---અસર કહે છે.

Write answers of any ten questions in brief

(20)

Q-3

નીચેનામાંથી દશ(10) પ્રશ્નો ના જવાબ દ્રોંક માં લખો

1 સ્થાયી બાયસ માટેની જરૂરિયાત લખો

2 ફિક્સ્ડ બાયસ પરિપથની મર્યાદા વિશે વર્ણવો

3 NPN અને PNP ટ્રાન્ઝિસ્ટરની પરિપથ સંજ્ઞા દોરો.

- 4 બહુસ્તરીય એમ્પલીફાયરની જરૂરિયાત લખો
- 5 dB નો કેમ ઉપયોગ થાય છે?
- 6 એક સ્તરીય એમ્પલીફાયરના ઉપયોગો લખો
- 7 શ્રાવ ફીડબેકના આંતરીક અને બાધ્ય અવરોધના સમીકરણ લખો
- 8 (૧) પ્રવાહ લબ્ધિ (૨) વોલ્ટેજ લબ્ધિ વ્યાખ્યાયિત કરો
- 9 ઓસીલેટરના પરિપથની મૂળભૂત જરૂરિયાત લખો
- 10 શ્રેષ્ઠી- કરંટ અને સમાંતર- વોલ્ટેજ વાળો પરિપથ દોરો.
- 11 વેઇન બ્રિજ ઓસીલેટરના કાર્ય નો સિંધ્યાત વર્ણવો.
- 12 સાઈન્યુસોઇડલ અને નોન સાઈન્યુસોઇડલ ઓસીલેટર વચ્ચે નો તફાવત આપો.

**Q- 4 Answer the following questions (Attempt any 4 out of 8)** (32)

નીચેના ૮ પ્રશ્નોમાંથી ૪ પ્રશ્નોના જવાબ વિસ્તૃતમાં લખો

- 1 વોલ્ટેજ ડિવાઈડર બાયસિંગ પરિપથ એટલે શુ? જરૂરિ ડાયગ્રામસાથે અંદાજિત (approximate) પૂથકકરણ થી પરિપથનું કિયાશીલ બિંદુ મેળવો.
- 2 કિયાશીલ બિંદુ એટલે શુ? કિયાશીલ બિંદુ નિ બરાબર પસંદગી વિશે વર્ણવો
- 3 જરૂરિ ડાયગ્રામસાથે h (hybrid)-પેરામીટર મેળવો. અને તેના સમકક્ષ પરિપથ વિશે વિસ્તૃત ચર્ચા કરો
- 4 નાના સિન્ઝલ વાળા એમ્પલીફાયર એટલે શુ? એમ્પલીફાયરનો પરિપથ દોરી તેના દરેક ઘટક વિશે વિસ્તૃત ચર્ચા કરો
- 5 જરૂરિ પરિપથના ઉપયોગથી ફીડબેક એમ્પલીફાયરની વોલ્ટેજ લબ્ધિ વિશે વર્ણવો
- 6 બાયપાસ કેપેસિટર વગાર RC કલ એમ્પલીફાયરની વિસ્તૃત ચર્ચા કરો
- 7 હાર્ટ્લેને ટોલપિટ્સ ઓસીલેટર વિશે નોંધ લખો.
- 8 RC ઓસીલેટરનો મૂળભૂત સિંધ્યાત લખો. ફેઝ શિફ્ટ ઓસીલેટર વિશે વિસ્તૃત ચર્ચા કરો

\* \* \* \* \*

(5)

